

16<sup>th</sup> August, 2021

**BSE Limited**  
Phiroze Jeejeebhoy Towers,  
Dalal Street, Fort,  
Mumbai - 400 001

**Company Code No. 531640**

Dear Sir,

**Sub: Submission of Newspaper clippings - Advertisement of Notice of AGM, Book Closure & E-Voting**


Further to our letter dated 13<sup>th</sup> August, 2021 submitting therewith Notice of Annual General Meeting and Annual Report - 2020-21, we are enclosing herewith clippings of Newspapers Advertisement published on 15<sup>th</sup> August, 2021 for your information and records.

This is in due compliance of the relevant Regulations of the SEBI (LODR) Regulations, 2015.

Thanking you,

Yours faithfully,

For, SUVIDHA INFRAESTATE CORPORATION LIMITED

  
**KISHORE KUMAR K. GOSWAMI**  
MANAGING DIRECTOR  
(DIN:00289644)





## Covid hospitalisation rate among young US adults highest

**Washington,** The recent Covid-19 hospitalisation rate among young American adults aged between 30 to 39 is the highest ever since the pandemic hit the US early last year, while that among seniors aged 70 and above is about a quarter of what it was this January, according to the Centers for Disease Control and Prevention (CDC).

Meanwhile, children account for a larger share of hospitalisations now than they did in January, as the rate among those under the age of 18 hovers right around the record high, Xinhua news agency quoted the CDC as saying in its latest update on Friday.

In a few states, including Georgia, Tennessee, South Carolina and Louisiana, the number of children hospitalised with Covid-19 more than doubled over the past week, it said.

Florida has the highest hospitalisation rate in the country, a CNN report said on Friday citing the latest data from the US Department of Health and Human Services (HHS). More than 65 people are hospitalised with Covid-19 for every 100,000 people in Florida, about one out of every 1,500 state residents.

## US consumer sentiment fails to decade low

**Washington,** US consumer sentiment in early August fell to its lowest level in a decade amid concerns over the spread of the Delta Covid-19 variant, according to a survey released by the University of Michigan.

The preliminary consumer sentiment index fell to 70.2 in the first half of August from a final reading of 81.2 in July, marking the lowest level since 2011, the survey released on Friday revealed.

"Consumers reported a stunning loss of confidence in the first half of August," Richard Curtin, chief economist for the survey, said in a statement, adding the losses were widespread across age and education subgroups and observed across all regions.

There is little doubt that the pandemic's resurgence due to the Delta variant has been met with a mixture of reason and emotion.

"Consumers have correctly reasoned that the economy's performance will be diminished over the next several months, but the extraordinary surge in negative economic assessments also reflects an emotional response, mainly from dashed hopes that the pandemic would soon end," he added. The fall in consumer sentiment came as Covid-19 cases, hospitalisations and deaths are rising at a record level across the country.

## HDFC Bank inks MoU with I-Hub to support Start-ups

**Ahmedabad,** Continuing its robust efforts to support and mentor start-ups, HDFC Bank, India's largest private-sector bank, has signed a Memorandum of Understanding (MoU) with I-Hub (Gujarat Student Start-up and Innovation Hub), a Government of Gujarat - supported centre to support student start-ups and innovations. Located in Ahmedabad, Gujarat, I-Hub is a catalyst to boost the start-up ecosystem by supporting the entrepreneurial spirit of the youth.

As part of this collaboration, HDFC Bank will provide end-to-end banking solutions and mentorship to the start-ups incubated at I-Hub.

## Twitter making contrast changes as users report eye strain

**New Delhi,** After several users reported eye strain, headaches and even migraines owing to the high visual contrast in new Twitter design with buttons, links and new font called Chip, the micro-blogging platform on Saturday announced to change the contrast on all buttons.

The company said in a post that it is making contrast changes on all buttons to make the experience on the eyes "because you told us the new look is uncomfortable for people with sensory sensitivities".

"We're listening and iterating. We've identified issues with the Chip font for Windows users and are actively working on it," the Twitter Accessibility account posted. After Twitter announced a new redesign of its website with a new font this week, some users took to the platform saying it is difficult for them to read the posts.

## Google infringed on 50 Sonos patents, rules US judge

**San Francisco,** A US judge has ruled that Google infringed upon the patents of high-tech speaker and audio technology company Sonos.

According to an initial ruling from a US International Trade Commission (ITC) judge, Google infringed on five Sonos patents.

"We are pleased the ITC has confirmed Google's blatant infringement of Sonos' patented inventions. This decision reaffirms the strength and breadth of our portfolio, marking a promising milestone in our long-term pursuit to defend our innovation against misappropriation by Big Tech monopolies," Sonos Chief Legal Officer Eddie Lazarus told TechCrunch on Friday. In January last year, Sonos sued tech giant Google for allegedly copying its wireless speaker design, using the International Trade Commission (ITC) to ban Google products like laptops, phones and speakers.

## S.Africa to seek opportunities on BRICS Business Forum

**Johannesburg,** South Africa would use the BRICS Business Forum to showcase what the country can offer, improve confidence and attract investment, said an official.

On Friday, Buzi Mabasa, chairperson of the Chairperson of the South African chapter of the BRICS Business Council, said the country intended to use the opportunity presented by the BRICS Business Forum to showcase new possibilities and opportunities within the regions, reports Xinhua news agency.

"In an environment where sentiment globally is bearish, when the pause button is pressed by many investors, we want to make sure that opportunities in BRICS stand out," she said.

India will host the BRICS Business Forum virtually on August 16-18.

Mabasa said she will go with captains of industry from various sectors to lure investors into the country. She explained that in the Forum they want to identify challenges and opportunities to ensure greater economic trade and investment ties amongst the BRICS countries.

Mabasa expressed confidence in BRICS countries' capability to drive economic development amongst those countries. There is a consensus amongst our partners that there are opportunities in our economies to unlock growth and allow for development.

## Nepal announces relief measures for Covid-affected enterprises, individuals

**Kathmandu,** Nepal's central bank has announced a set of relief measures for enterprises and individuals badly affected by the Covid-19 pandemic as the country's economic recovery is being reversed by the second wave.

The Nepali government was forced to re-impose a lockdown in late April in the Kathmandu Valley and other parts of the country to cope with the second wave of the epidemic that befell earlier in the month a month earlier than the recovery process, reports Xinhua news agency. While unveiling the monetary policy for the 2021-22 fiscal year that began in mid-July, Governor of Nepal Rastra Bank Maha Prasad Adhikari on Friday announced a number of relief measures, including the extension of loan repayment deadline, reduction of installment amount, restructuring and rescheduling of loans and credits at cheaper interest rates, for enterprises.

## WESTERN RAILWAY TO RUN 4 FULLY RESERVED SPECIAL TRAINS TO VARIOUS DESTINATIONS

### Regular Run of Special Trains till Further Advice

Train No.	Originating Station & Destination	Date of Commencement	Departure	Arrival
09073	Bandra Terminus - Gandhidham (Superfast Weekly Special)	w.e.f. 20/08/2021	14.40 hrs. (Friday)	05.40 hrs. (Next Day)
09074	Gandhidham - Bandra Terminus (Superfast Weekly Special)	w.e.f. 19/08/2021	20.45 hrs. (Thursday)	11.55 hrs. (Next Day)

**Halts :** Borivali, Vapi, Valsad, Surat, Vadodra, Ahmedabad, Viramgam, Surendranagar, Bikaner, Morvi, Samakhiali and Bhachau stations in both directions.

**Composition :** AC 2-Tier, AC 3-Tier, Sleeper Class and Second Class Seating Coaches.

09035	Mumbai Central - Porbandar (Daily Special)	w.e.f. 18/08/2021	09.20 hrs. (Daily)	05.30 hrs. (Next Day)
09036	Porbandar - Mumbai Central (Daily Special)	w.e.f. 21/08/2021	21.20 hrs. (Next Day)	19.30 hrs. (Next Day)

**Halts :** Dadar, Borivali, Virar, Saphale, Palghar, Boisar, Dahanu Road, Gholvad, Umbargam Road, Sanjan, Bhilai, Vapi, Udvarda, Pardi, Valsad, Bilimora, Amalsad, Navsari, Marol, Udhna, Surat, Sayan, Kim, Kosamba, Paroli, Amleshwar, Bheruch, Nabhup, Vijay, Miyagam Karjan, Rota, Vishvamitri, Vadodra, Vasad, Anand, Kanjari Boriyavi, Nadiad, Mahamadavad Kheda Road, Barojdi Nandaj, Maninagar, Ahmedabad Jn., Sabarmati Jn., Chandiodiya, Sanand, Viramgam, Surendranagar, Than, Wankaner, Rajkot, Hapa, Jamnagar, Bharvad and Ranavav stations in both directions. (Train No. 09035 will have an additional halt at Vasal Road station.)

**Composition :** AC 3-Tier, Sleeper Class and Second Class Seating Coaches.

09229	Mumbai Central - Hisar (Bi-weekly Duronto Superfast)	w.e.f. 17/08/2021	23.00 hrs. (Tue & Sun)	20.35 hrs. (Next Day)
09230	Hisar - Mumbai Central (Bi-weekly Duronto Superfast)	w.e.f. 19/08/2021	10.00 hrs. (Tue & Thur)	(Next Day)

**Halts :** Vadodra, Ratlam, Sawai Madhopur, Jaipur, Sikar, Jhunjhunu, Loharu and Sadulpur stations in both directions.

**Composition :** AC First Class, AC-2 Tier and AC-3 Tier Coaches.

09519	Bhavnagar Terminus - Okha (Daily Special)	w.e.f. 18/08/2021	22.10 hrs. (Daily)	12.55 hrs. (Next Day)
09520	Okha - Bhavnagar Terminus (Daily Special)	w.e.f. 19/08/2021	15.15 hrs. (Daily)	05.30 hrs. (Next Day)

**Halts :** Bhavnagar Para, Sitor Gujarat, Songadi, Dhola Jn., Botad, Ranpur, Limbdi, Wadhwan City, Joravarnagar, Surendranagar Gate, Surendranagar, Than, Daladi, Wankaner, Sindhawadar, Rajkot, Paddhari, Hadmalia Jn., Jalya Devani, Jamwanthali, Aiyavada, Hapa, Jamnagar, Lakhabawal, Pipli, Kanalsu, Modpur, Khambalia, Bhatel, Bhopalka, Bhatiya, Dwarka, Bhimrana and Mitthapur stations in both directions. (Train No. 09519 will have additional halt at Botad, Amarsar & Kanakot stations and Train No. 09520 will have additional halt at Dispur, Mull Road, Ramparda & Vagdiya stations.)

**Composition :** Sleeper Class and Second Class Seating Coaches.

## INCREASE IN FREQUENCY OF ONE PAIR OF SPECIAL TRAIN & RESTORATION OF ONE PAIR OF SPECIAL TRAIN

### Increase In Frequency (Tri-weekly to Daily till Further Advice)

Train No.	Frequency	From	To	Restoration w.e.f.
09029	Daily	Bandra Terminus	Ahmedabad	16/08/2021
09030	Daily	Ahmedabad	Bandra Terminus	16/08/2021

### Restoration of Trains

09055	Tuesday	Valsad	Jodhpur Jn.	17/08/2021
09056	Wednesday	Jodhpur Jn.	Valsad	18/08/2021

For detailed timings of the halts of respective special trains, please visit [www.enquiry.indianrail.gov.in](http://www.enquiry.indianrail.gov.in)

Only passengers having confirmed tickets will be permitted to board these special trains. Passengers are advised to adhere all norms, SOPs related to COVID-19 during the boarding, travel and at destination.

The Booking of Train Nos. 09035, 09036, 09229, 09519 & 09520 will open on 15th August, 2021 and Train Nos. 09073 & 09074 will open on 16th August, 2021 at mentioned P.S. counters and RTC website. Above trains will run as fully reserved trains.

**WESTERN RAILWAY**  
www.indianrailways.gov.in  
Like us on Facebook.com/WesternRailway  
Follow us on Twitter.com/WesternRailway

**PL. CARRY ID PROOF FOR ALL RESERVED TKTS.**

## SHIVANSH FINSERVE LIMITED

Regd. & Corporate Office: 22 First Floor, Harshid Complex, Opp. Kalpavriksh Commercial Complex, Income Tax, Ashram Road, Ahmedabad - 380009.  
Contact No: 7327543337. Email: [shivanshfinserve@gmail.com](mailto:shivanshfinserve@gmail.com). Website: [www.shivanshfinserve.com](http://www.shivanshfinserve.com)

### ANNEXURE I EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2021

PARTICULARS	[Rs. in lakhs except EPS]			
	Quarter ending (30/06/2021)	Quarter ending (31/03/2021)	Quarter ending (30/06/2020)	Year to date Figures (31/03/2021)
1 Income from operations	-	107.77	46.61	256.43
2 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items#)	(5.08)	16.98	(0.38)	11.07
3 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items#)	(5.08)	16.98	(0.38)	11.07
4 Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items#)	(7.41)	14.72	(0.38)	7.98
5 Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(7.41)	14.72	(0.38)	7.98
6 Equity Share Capital	624.00	624.00	624.00	624.00
7 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of	-	-	-	17.62
8 Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	(0.12)	0.24	(0.01)	0.13
Basic Diluted	(0.12)	0.24	(0.01)	0.13

Notes: 1. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Bombay Stock Exchange and the listed entity [www.shivanshfinserve.com](http://www.shivanshfinserve.com).  
2. The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote.  
3. # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / IAS Rules, whichever is applicable.

**Place - Ahmedabad For and on behalf of Board of Directors**  
**Date - 14.08.2021** SHIVANSH FINSERVE LIMITED  
Sd/-  
Jignesh Sudhirbhal Shah  
Director  
Din: 02112343

## KANUNGO FINANCIERS LIMITED

CIN: L67120GJ192PLC086450  
REGD. OFFICE: - B-7, B wing, 5th Floor Ajanta Commercial Center, Income Tax, Ahmedabad - 380009.  
(0) 79-48002688, Mail: [kanungofinanciers@gmail.com](mailto:kanungofinanciers@gmail.com), website: [www.kanungofinanciers.com](http://www.kanungofinanciers.com)

### ANNEXURE I EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2021

PARTICULARS	[Rs. in lakhs except EPS]			
	Quarter ending (30/06/2021)	Quarter ending (31/03/2021)	Quarter ending (30/06/2020)	Year to date Figures (31/03/2021)
1 Income from operations	-	-	-	-
2 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items#)	(191.25)	(31.34)	(0.53)	(14.44)
3 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items#)	(191.25)	(31.34)	(0.53)	(14.44)
4 Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items#)	(195.10)	(42.32)	(0.53)	(29.67)
5 Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(171.49)	14.49	(0.53)	52.20
6 Equity Share Capital	463.40	463.40	463.40	463.40
7 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	35.54
8 Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	(4.21)	(0.91)	(0.01)	(0.64)
Basic Diluted	(4.21)	(0.91)	(0.01)	(0.64)

Notes: 1. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Bombay Stock Exchange and the listed entity [www.kanungofinanciers.com](http://www.kanungofinanciers.com).  
2. The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote.  
3. # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / IAS Rules, whichever is applicable.

**Place - Ahmedabad For and on behalf of Board of Directors**  
**Date - 14.08.2021** KANUNGO FINANCIERS LIMITED  
Sd/-  
Chirag K. Shah  
Director  
Din: 08111288

## PURPLE ENTERTAINMENT LIMITED

CIN: L55101GJ1974PLC084389  
Regd. Office: - 30-B, 3rd floor, Ajanta complex, Income Tax, Ashram Road, Ahmedabad - 380009.  
Email: [purpleentertainment7@gmail.com](mailto:purpleentertainment7@gmail.com), website: [www.purpleentertainment.co.in](http://www.purpleentertainment.co.in)

### ANNEXURE I EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2021

PARTICULARS	[Rs. in lakhs except EPS]			
	Quarter ending (30/06/2021)	Quarter ending (31/03/2021)	Quarter ending (30/06/2020)	Year to date Figures (31/03/2021)
1 Income from operations	-	-	-	-
2 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items#)	9.90	(7.97)	7.63	33.25
3 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items#)	9.90	(7.97)	7.63	33.25
4 Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items#)	7.37	(10.56)	5.65	24.66
5 Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	7.37	(10.56)	5.65	24.66
6 Equity Share Capital	864.60	864.60	864.60	864.60
7 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of	-	-	-	22.21
8 Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	0.09	(0.12)	0.07	0.29
Basic Diluted	0.09	(0.12)	0.07	0.29

Notes: 1. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Bombay Stock Exchange and the listed entity [www.purpleentertainment.co.in](http://www.purpleentertainment.co.in).  
2. The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote.  
3. # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / IAS Rules, whichever is applicable.

**Place - Ahmedabad For and on behalf of Board of Directors**  
**Date - 14.08.2021** Purple Entertainment Limited  
Sd/-  
Chirag Sudhirbhal Shah  
Director  
Din: 08012494

## SUVIDHA INFRAESTATE CORPORATION LIMITED

[CIN: L71020GJ192PLC016979]  
Registered Office: A-305, 306 Krishna complex, Opp. Devashish figure, Bodadke, Ahmedabad - 380 054

**NOTICE FOR 29th ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING**  
NOTICE is hereby given that the 29th Annual General Meeting ("AGM") of the members of the Company will be held on September, 2021 at 12.00 noon, on the 29th September, 2021 at 12.00 noon, through Video Conference ("VC") Other Audio Visual Means ("OAVM") to transact the business as set out in the Notice dated 26th July, 2021 convening the AGM. The Company has sent the Annual Report 2020-21 along with the Notice convening the AGM through electronic mode only to the members whose email addresses are registered with the Company and/or Depositories in accordance with the Circular issued by the Ministry of Corporate Affairs dated 5th May, 2020 read with its circulars dated 8th April, 2020, 13th April, 2020, 15th June, 2020 and dated 13th January, 2021 and SEBI circular dated 12th May, 2020 and dated 15th January, 2021. The Annual Report along with the Notice convening the AGM is also available on the website of the Company at [www.svidha.com](http://www.svidha.com) and on the website of Central Depository Services (India) Limited at [www.evotingindia.com](http://www.evotingindia.com) and also on website of ESE, Limited at [www.eselimited.com](http://www.eselimited.com).

NOTICE is hereby further given that pursuant to Section 91 of the Companies Act, 2013 read with rules made there under and as per Regulation 42 of SEBI (LODR) Regulations, 2015, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Tuesday, the 21st September, 2021 to Monday, the 27th September, 2021 (both days inclusive), for the purpose of 29th AGM of the Company.

As per the Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015, the Company is providing its members the facilities to cast their vote by 'Remote e-voting as well as also 'e-voting' at the time of AGM on all the resolutions set forth in the said Notice. The details as required pursuant to the provisions of the Companies Act, 2013 and Rules made there under are given here under

1 Date of completion of dispatch of Notice of AGM through email only	13th August, 2021
2 Date & Time of commencement of Remote e-voting	9.00 a.m. on 24th September, 2021
3 Date & Time of end of Remote e-voting	5.00 p.m. on 26th September, 2021
4 Cut-off date for determining rights of entitlement of Remote e-voting	20th September, 2021
5 Those persons who have acquired shares and have become members of the Company after emailing off notice of AGM by the Company and whose names appear in the Register of Members of the Company/ in the statement of beneficial owners maintained by depositories as on cut-off date can exercise their voting rights through Remote e-voting by following the procedure as mentioned in the said Notice of AGM.	
6 Remote e-voting shall not be allowed beyond	After 5:00 p.m. on 26th September, 2021
7 Manner of casting e-votes on resolution during AGM (VCOAVM)	E-voting facility will be available during AGM. Members who have already cast their vote by remote e-voting prior to the AGM may remain present at AGM through VCOAVM but shall not be entitled to cast their e-vote again during AGM.
8 Electronic voting system & VCOAVM platform provider	Central Depository Services (India) Limited <a href="http://www.evotingindia.com">www.evotingindia.com</a>
9 Contact details of person responsible to address the grievances connected with e-voting system	Mr. Rakesh Dalvi, Manager Central Depository Services (India) Limited 25th Floor, A Wing, Marathon Futurex, Marfatil Mills Compound, NM Joshi Marg, Lower Parel (E), Mumbai - 400 013 E Mail ID - <a href="mailto:helpdesk.evoting@cdslindia.com">helpdesk.evoting@cdslindia.com</a> Phone No. - 1800 225533

By Order of the Board  
for SUVIDHA INFRAESTATE CORPORATION LIMITED  
Sd/-  
Krunal Thakkar  
Company Secretary & Compliance Officer  
**Place - Ahmedabad Date : 13th August 2021**

